https://archive.org/details/bk943/page/n0/mode/1up

1990 Around -Gujarat Samachar -Charotar Patidar & Parampara (943)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

પિરાણાના ઈમામ શાહ બાવાના રોજામાં

ચરોતરનું પાટીદાર પરિવાર અને ૫૦૦ વર્ષ પુરાણી પરંપરા

અમદાવાદ, સોમવાર

અમદાવાદથી ૨૦ કિલોમિટર દૂર પીરાણા ગામ આવેલું છે. આ ગામમાં પંદરમી સદીમાં નિર્માણ પામેલો શ્રી ઈમામશાહ બાવાનો રોજો છે, જેમાં છેલ્લાં ૫૦૦ વર્ષથી ઘીની ત્રણ અખંડ જ્યોત જલી રહી છે.

ઈમામશાહ બાવાના રોજામાં જલતી ઘીની જ્યોત સામે એક સમયે મોગલ બાદશાહ ઔરંગઝેબે ભારે વિરોધ કરેલો પરંતુ પાછળથી ઈમામશાહ બાવા કોઈ ચમત્કારથી બાદશાહે શાહી ખજાનામાંથી ઘીની આ જ્યોત માટે વાર્ષિક ૬૦ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો હતો.

ઔરંગઝેબે ચાલુ કરેલો આ સિલસિલો પેશ્વાઓ અને અંગ્રેજોએ પણ તોડ્યો નહોતો. આજે પણ આ પ્રથા જારી રાખીને ... સરકાર વર્ષે ૬૦ પૈસા આ ઘીની જ્યોત માટે ફાળવે ...

કોમી એકતાની ભાવનાને ... જ્યૂતી પ્રેરે તેવા આ રોજામાં ... દીવો અને લોબાન-ધૂપ બંને ... થાય છે. આ પવિત્ર લેખાતા ... એક તરફ ... ગુલાલથી પૂજા થાય છે, ... ધરાવાય છે; તો બીજી તરફ ... ઉપર ચાદર પણ ઓઢાડાય ...

... રૂપના રૂપે ... શ્રી ... બાવાની દરગાહને ... થાય છે તો શુક્રવારી ... પૂજા-વિધિ કરીને ૩૨ ...

હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પીરાણાનો રોજો

... ભોજન ... ધરાવાય છે. ... જ તેવા મળતાં ... મુસ્લિમ સં... તિના અજોડ ... આ સ્થા...માં ધર્મ અને ... ભેદભાવ ... રીને સર્વ કોઈ ... પ્રવે...ને સૂફી-સંત ... સઘળા ... પોતાની ઈચ્છા ... ભાવ્યો ... ત કરે છે. ... મકબરા ... અને સુ... ... ઈમામશાહ ... દરગાહનાં ... જમણી તરફ ... ની બીજી ... દરગાહ ... રેલી છે. આ ... બંને દર... વચ્ચે ... ચીનો પડદો ...



ઈમામ શાહ બાવાના આ રોજામાં દરગાહ સમક્ષ લોબાન-ધૂપ થાય છે તો બીજી તરફ કળશ-પૂજા થાય છે, ને ૩૨ ભોજનના થાળ ધરાવાય છે.

હિન્દુ પરિવાર સંભાળી રહેલ છે. ઈમામશાહના અનુયાયીઓ સત્પંથી તરીકે ઓળખાય છે.

પરંપરાથી ધરાવતા જગ્યાના આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ ૨૨મા ગાદીપતિ છે. સ્થળની પ્રાચીનતા અને ઈતિહાસ વિષે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, શ્રી ઈમામ શાહના વડવાઓ ૧૪માં

સોનાનાં પાંચ કળશ ધરાવતા મકબરા હેઠળ શોભતી શ્રી ઈમામ શાહ બાવાની દરગાહ.

સૈકામાં પશ્ચિમના દેશોમાંથી આવીને પંજાબમાં વસ્યા હતા. ત્યાંના મુલતાન ગામમાં ઈમામ શાહનો જન્મ થયો હતો.

આ સમયગાળા દરમિયાન દેશભરમાં કોમવાદે જોર પકડ્યું હતું. કોમ-કોમ વચ્ચેની આ વેર

છેલ્લાં ૫૦૦ વર્ષથી આ જગ્યાનો વહીવટ હાલના ગાદીપતિ આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજની ૨૨ પેઢી સંભાળતી આવી છે.

(તસવીરો : જી. એચ. માસ્ટર)

... જુએ છે.

જ્યારે ડાબી ... જુ તેમના દીકરા ... અલી ... ઇમામશાહની ... દરગાહ આવેલી ... પિતા-પુત્ર બંનેની દરગાહ ઉપર ... પૂર્વક એવા ચાંદીના તાજ શોભે ... રહ્યા છે.

ઈમામશાહ બાવા ... આ જગ્યા અને તેની જમીન ... જમીનોના વહીવટ છેલ્લાં ૫૦૦ વર્ષથી એક

વાલસાને શમાવવા અને શાંતિની અહાલેક જગાવવા ઈમામ શાહે દેશ આખાનું પરિભ્રમણ કર્યું. પોતે મુસ્લીમ હોવા છતાં અથર્વવેદનો અભ્યાસ કરીને તેનો ઉપદેશ કર્યો.

પરિભ્રમણને અંતે તેઓ પિરાણા નજીકના ગીરમથા ગામે આવ્યા. ત્યાં ૭ વર્ષનો સતત દુષ્કાળ હતો. ચમત્કારિક રીતે વરસાદ વરસાવી ત્યાંના પટેલો પાસે મંદિર બનાવવા જમીનની માંગણી કરી. અને પિરાણા ઉપર પસંદગી ઉતારી આ મકબરા મંદિરનું નિર્માણ કર્યું.

શ્રી ઈમામશાહ બાવાએ પાંચ પટ્ટ શિષ્યો બનાવેલા. જેમાં ચરોતરના પટેલ શાણકાકાને આ સ્થળનો વહીવટ સઘળો વહીવટ સોંપીને તેઓ સમાધિસ્થ બનેલ. તેમની પાદુકાની ગુલાબ અને ચંદનથી પૂજા થાય છે. તેમજ કળિયુગને અનુલક્ષીને કળશ કુંભની મંદિરની વિધિ જેમ જ અહીં પૂજા થાય છે. પૂજાના પ્રારંભે આહવાન પણ અપાય છે.

અહીં કળશ-પૂજા સજોડે આરતી ઉતારીને કરવામાં આવે છે. સંધ્યાટાણે નવી પૂજા વખતે ધૂપ-લોબાન થાય છે. અને નગારું પણ વગાડાય છે. અને ચૈત્ર સુદિ બીજ અને શુક્રવારી બીજે અહીં મેળો-ઉર્સ ભરાય છે. ઈમામ શાહે આપેલા ઉપદેશની શિક્ષાપત્રી પણ બહાર પાડવામાં આવી છે.

અથર્વવેદ અનુસાર કળિયુગમાં ભૂમિદાનનું માહાત્મ્ય છે. ત્રિવેણી સંગમમાં અસ્થિ પધરાવવાનું જે મહત્વ લેખાય છે તે આ સ્થાનમાં પધરાવવાનું સત્પંથીઓ માને છે. આ જગ્યામાં અસ્થિ પધરાવાની અસંખ્ય તકતીઓ પણ જોવા મળે છે.

ઈમામ શાહના આ રોજા ઉપર અથર્વવેદને આધારીત શ્વેત ધજા ફરકે છે. અને તેમના અનુયાયીઓ પણ શ્વેત વસ્ત્ર પરિધાન કરે છે.

હિન્દુઓ જેને મંદિર ગણે છે અને મુસ્લિમો જેને રોજો કહે છે, તેવા આ પવિત્ર સ્થાનમાં છેલ્લી પાંચ સદીથી અન્નક્ષેત્ર પણ ચાલ્યું આવે છે.

નિષ્કલંકી નારાયણ ભગવાનને ભજવવાનો ઉપદેશ દેનાર શ્રી ઈમામ શાહને સત્પંથીઓ ઈમામ ગોર તરીકે પણ ઓળખે છે. પરિભ્રમણ દરમિયાન તેમણે અનેક સ્થળોએ ચમત્કાર કર્યા હોવાનું પણ કહેવાય છે.

શ્રી કરસનદાસજી મહારાજના જણાવ્યા અનુસાર સરેરાશ દરરોજ આઠસોથી હજાર જેટલા શ્રદ્ધાળુઓ અહીં આવે છે. સૌરાષ્ટ્ર, ઑરિસ્સા, બંગાળ, મહારાષ્ટ્ર-ખાનદેશ વગેરે જેવા દૂરદૂરનાં સ્થળોએથી પણ બાવામાં વિશ્વાસ ધરાવનારાઓ આવતા રહે છે.

ઈમામ શાહ બાવા રોજા સંસ્થા ટ્રસ્ટના નેજા હેઠળ જગ્યાનો વહીવટ ચાલે છે. ૪૦ જેટલા માણસો અહીં વ્યવસ્થામાં રોકાયેલા છે. અહીંની ૪૫ વીઘાં જમીનનો મહેસૂલ પણ સરકારે માફ કર્યો છે.

— પ્રકાશ રાવલ

જામનગરના રાજા મનોહરસિંહ વેચવા મુ...

આર્થિક ભીડમાંથી બહાર ... જાડેજાની કરોડો રૂપિયાની ... અપાયેલી મંજૂરી સામે વિવિધ મનોહરસિંહજી જાડેજાનું ત્રણ ... મંજૂરી આપવામાં આવી છે. ... શત્રુશલ્યસિંહજી ઉપર રૂપિયા ... જમીન વેચવા ઈન્કાર કરાયા.

દિલ્હીના રાજ...

ગુજરાતના તેમ જ ભારતના રાજવીઓએ નવી દિલ્હી ખાતે ... બાબતમાં રજૂઆતો કરી છે. ... રાજકુટુંબોના વેલ્થ ટેક્સ તેમ એસ્ટેટ ડ્યૂટીના જૂના લેણાંઓ બા... અને તેઓ એ ચૂકવી શકતા નથી એ... તેમને પણ તેમના દેવાં ભરવાં ... જમીન ટોચમર્યાદા ધારામાંથી ... મળવી જોઈએ એવી તેમની દલીલો ... વિશ્વાસપાત્ર માહિતી અનુસાર દિ... પણ આ નિર્ણયથી આશ્ચર્ય થયું છે ... ખાનગીમાં નારાજી પણ વ્યક્ત કર... આવી છે.

જામનગરના કેટલાક રા... વર્તુળોએ દિલ્હી ખાતે એવી રજૂઆત ... છે કે શ્રી શત્રુશલ્યસિંહજી ઉપર એ...

નબળી કામગીરી

[છેલ્લા પાનાનું ચાલુ]

મળ્યો. શ્રી હરૂભાઈ મ... અમદાવાદની સંસદની બેઠકની ... હરગીઝ નહીં આપવી જોઈએ ... કાર્યકરોએ માગણી કરી હતી.

આજ રીતે રખિયાલ વિધાન ... મતવિસ્તારના રાયપુર અને બાપુનગ... કાર્યકરોએ વર્તમાન ધારાસભ્ય હસમુખ પટેલ સામે સખ્ત વિરોધ ... હતો ને જણાવ્યું હતું કે વિધાનસભા ... તેઓ હરગીઝ ચાલી શકે તેમ ... તેમના સ્થાને બીજા ઉમેદવાર ... કરવા જોઈએ નારણપુરા, વાડજ સાબરમતીના કાર્યકરોએ વર્ત... ધારાસભ્ય શ્રી ભરત ગઢવી, ... અમરાઈવાડી, ખોખરા મણીનગરના કાર્યકરોએ વર્ત... ધારાસભ્ય શ્રી રમલાલ રૂપલાલ સામે ... વ્યક્ત કર્યો હતો આ ધારાસભ્યો ચૂં... પછી લોકોના સંપર્કમાં રહ્યા નથી. તે... તેમની કામગીરીઓ નબળી છે. ... રજૂઆતો થઈ હતી ને તેમને ટિ... નહીં આપવા માગણીઓ કરી હ...

આજે સવારે કીરદાર ફ્લેટ મા... હીરાલાલ ગુપ્તાના અધ્યક્ષપદે મળેલ ... શહેર કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં ... કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ... ચૂંટણીઓ કોંગ્રેસ માટે પડકારરૂપ ... લોકકાર્યકરોએ શ્રી. રાજીવ ગાંધીના ... મજબૂત કરવાના ક્રમમાં લાગી જોઈએ. કોંગ્રેસને વિરોધ પક્ષનો ... નથી.

શ્રી ગુપ્તાએ બંધ મીલો, ... કામદારો, જીવન જરૂરી ચીજોના ... ભાવ વિગેરે પ્રશ્નો રજુ કર્યા હ...

અધમકામાનું રાજકારણ

ખંભાત: તાજેતરમાં કહે છે ... પાણીના કકળાટની બાબતે સત્યનાર... ભારવાડાની બહેનોનો મોરચો ... સામાજીક કાર્યકર શ્રી પીનાકીન બ્રહ્... ખંભાત નગરપાલિકાએ ગયેલા તેની ... રાખી ચુનારા કોમના ચાર યુવાનોરે ... છે. અમારા કાકા છગનભાઈ ચુનારા ... કેમ ગયા હતા તેમ કહી હીરા ઘસ... કારખાનામાંથી અંગુરથી હુમલો ... ગડદા પાટુનો માર મારતા ખંભાતના ... ગંદારાજકારણ સામે લોકોમાં રોષ ... સનસનાટી મચી જવા પામી હો... જાણવા મળે છે. સામ સામી પોલી... ફરિયાદો થયાનું પણ જાણવા મળે

સારા વર્ષના નિશાની

મહેમદાવાદ : તાજેતરમાં સુસવાટા અને ધૂળની ડમરીઓ આંધી સાથે મહેમદાવાદ તાલુ... મેઘરાજાની પધરામણી થતા ખેડુ... આનંદની લાગણી ફેલાઈ છે. ...

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk943/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk943/page/n2/mode/1up

realpatidar.com

હિત કારક ઈમામ શાહ બાવાના રોજામાં

ચરોતરનું પાટીદાર પરિવાર અને ૫૦૦ વર્ષ પુરાણી પરંપરા

અમદાવાદ, સોમવાર

[illegible]

દૂર પીરાણા ગામ આવેલું છે. આ ગામમાં પંદરમી સદીમાં નિર્માણ પામેલો શ્રી ઈમામશાહ બાવાનો રોજો છે, જેમાં છેલ્લાં ૫૦૦ વર્ષથી ઘીની સતત અખંડ જ્યોત જલી રહી છે.

ઈમામશાહ બાવાના રોજામાં જલતી ઘીની જ્યોત સામે એક સમયે મોગલ બાદશાહ ઔરંગઝેબે ભારે વિરોધ કરેલો પરંતુ પાછળથી ઈમામશાહ બાવા કોઈ ચમત્કારથી બાદશાહે શાહી ખજાનામાંથી ઘીની આ જ્યોત માટે વાર્ષિક ૬૦ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો હતો. ઔરંગઝેબે ચાલુ કરેલો આ સિલસિલો પેશ્વાઓ અને [illegible] પણ તોડ્યો નહોતો. [illegible] પણ આ પ્રથા જારી રાખીને [illegible] સરકાર વર્ષે ૬૦ [illegible] આ ઘીની જ્યોત માટે ફાળવે [illegible]

[illegible] એકતાની ભાવનાને [illegible] પ્રેરે તેવા આ રોજામાં [illegible] દીવો અને લોબાન-ધૂપ બંને [illegible] થાય છે. આ પવિત્ર લેખાતા [illegible] એક તરફ [illegible]-ગુલાલથી પૂજા થાય છે, [illegible] ચઢાવાય છે; તો બીજી તરફ [illegible] ઉપર ચાદર પણ ઓઢાડાય [illegible]

[illegible]ના રૂપા ચાંદે શ્રી [illegible] બાવાની દરગાહને [illegible] થાય છે તો શુક્રવારી [illegible] પૂજા-વિધિ કરીને ૩૨

[illegible]હિન્દુ મુસ્લિમ [illegible]એકતાનું પ્રતીક [illegible] રોજો

[illegible] રોજો [illegible] રસાય છે. [illegible] જ તેવા મળતાં [illegible] સંસ્કૃતિના અજોડ [illegible] આ સ્થાનમાં ધર્મ અને [illegible] ભેદભાવ [illegible] સર્વ કોઈ [illegible] પ્રવેશીને સૂફી-સંત [illegible] સફળ પોતાની ઈચ્છા [illegible] કરે છે. [illegible] અને સુ[illegible] મકબરા [illegible] ઈમામશાહ બાવાના [illegible] દરગાહની જમણી તરફ તેમની [illegible] બીજી [illegible] દરગાહ [illegible] છે. આ બંને દર[illegible] વચ્ચે [illegible] પડદો



ઈમામ શાહ બાવાના આ રોજામાં દરગાહ સમક્ષ લોબાન-ધૂપ થાય છે તો બીજી તરફ કળશ-પૂજા થાય છે, ને ૩૨ ભોજનના થાળ ધરાવાય છે.

હિન્દુ પરિવાર સંભાળી રહેલ છે. ઈમામશાહના અનુયાયીઓ સત્પંથી તરીકે ઓળખાય છે.

પરંપરાગત રીતે ચાલતા ગાદીના આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ ૨૨મા ગાદીપતિ છે. સ્થળની પ્રાચીનતા અને ઈતિહાસ વિષે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, શ્રી ઈમામ શાહના વડવાઓ ૧૪મા

સોનાનાં પાંચ કળશ ધરાવતા મકબરા હેઠળ શોભતી શ્રી ઈમામ શાહ બાવાની દરગાહ.

સૈકામાં પશ્ચિમના દેશોમાંથી આવીને પંજાબમાં વસ્યા હતા. ત્યાંના મુલતાન ગામમાં ઈમામ શાહનો જન્મ થયો હતો.

આ સમયગાળા દરમિયાન દેશભરમાં કોમવાદે જોર પકડ્યું હતું. કોમ-કોમ વચ્ચેની આ વેર ભાવનાને શમાવવા અને શાંતિની અહાલેક જગાવવા ઈમામ શાહે દેશ આખાનું પરિભ્રમણ કર્યું. પોતે મુસ્લીમ હોવા છતાં અર્થવેદનો અભ્યાસ કરીને તેનો ઉપદેશ કર્યો.

પરિભ્રમણને અંતે તેઓ પિરાણા નજીકના ગીરમથા ગામે આવ્યા. ત્યાં ૭ વર્ષનો સતત દુષ્કાળ હતો. ચમત્કારિક રીતે વરસાદ વરસાવી ગામના પટેલો પાસે મંદિર બનાવવા જમીનની માંગણી કરી. અને પિરાણા ઉપર પસંદગી ઉતારી આ મકબરા મંદિરનું નિર્માણ કર્યું.

શ્રી ઈમામશાહ બાવાએ પાંચ પટ્ટ શિષ્યો બનાવેલા. જેમાં ચરોતરના પટેલ શાણકાકાને આ સ્થળનો વહીવટ સઘળો વહીવટ સોંપીને તેઓ સમાધિસ્થ બનેલ. તેમની પાદુકાની ગુલાબ અને ચંદનથી પૂજા થાય છે. તેમજ કળિયુગને અનુલક્ષીને કળશ કુંભની મંદિરની વિધિ જેમ જ અહીં પૂજા થાય છે. પૂજાના પ્રારંભે આહવાન પણ અપાય છે.

અહીં કળશ-પૂજા સાથોસાથ આરતી ઉતારીને કરવામાં આવે છે. સંધ્યાટાણે રની પૂજા વખતે ધૂપ-લોબાન થાય છે. અને નગારું પણ વગાડાય છે. અને ચૈત્ર સુદિ બીજ અને શુક્રવારી બીજે અહીં મેળો-ઉર્સ ભરાય છે. ઈમામ શાહે આપેલા ઉપદેશની શિક્ષાપત્રી પણ બહાર પાડવામાં આવી છે.

અથર્વવેદ અનુસાર કળિયુગમાં ભૂમિદાનનું માહાત્મ્ય છે. ત્રિવેણી સંગમમાં અસ્થિ પધરાવવાનું જે મહત્ત્વ લેખાય છે તે આ સ્થાનમાં પધરાવવાનું સત્પંથીઓ માને છે. આ જગ્યામાં અસ્થિ પધરાવવાની [illegible] પણ [illegible] છે.

ઈમામ શાહના આ રોજા ઉપર અથર્વવેદને આધારીત શ્વેત ધજા ફરકે છે. અને તેમના અનુયાયીઓ પણ શ્વેત વસ્ત્ર પરિધાન કરે છે.

હિન્દુઓ જેને મંદિર ગણે છે અને મુસ્લિમો જેને રોજો કહે છે, તેવા આ પવિત્ર સ્થાનમાં છેલ્લી પાંચ સદીથી અન્નક્ષેત્ર પણ ચાલતું આવે છે.

નિષ્કલંકી નારાયણ ભગવાનને ભજવાનો ઉપદેશ દેનાર શ્રી ઈમામ શાહને સત્પંથીઓ ઈમામ ગોર તરીકે પણ ઓળખે છે. પરિભ્રમણ દરમિયાન તેમણે અનેક સ્થળોએ ચમત્કાર કર્યા હોવાનું પણ કહેવાય છે.

શ્રી કરસનદાસજી મહારાજના જણાવ્યા અનુસાર સરેરાશ દરરોજ આઠસોથી હજાર જેટલા શ્રદ્ધાળુઓ અહીં આવે છે. સૌરાષ્ટ્ર, ઑરિસ્સા, બંગાળ, મહારાષ્ટ્ર-ખાનદેશ વગેરે જેવા દૂરદૂરનાં સ્થળોએથી પણ બાવામાં વિશ્વાસ ધરાવનારાઓ આવતા રહે છે.

ઈમામ શાહ બાવા રોજા સંસ્થા ટ્રસ્ટના નેજા હેઠળ જગ્યાનો વહીવટ ચાલે છે. ૪૦ જેટલા માણસો અહીં વ્યવસ્થામાં રોકાયેલા છે. અહીંની ૪૫ વીઘાં જમીનનો મહેસૂલ પણ સરકારે માફ કર્યો છે.

— પ્રકાશ રાવલ

છેલ્લાં ૫૦૦ વર્ષથી આ જગ્યાનો વહીવટ કરનાર ગાદીપતિ આચાર્ય શ્રી કરસનદાસજી [illegible] [illegible]જી ૨૨ પેઢી સંભાળતી આવી છે.

(તસવીરો : જી. એસ. માસ્ટર)

જુએ છે.

જ્યારે [illegible] જુ તેમના દીકરા [illegible] અહીં [illegible] દરગાહ [illegible] બંનેની દરગાહ ઉપર [illegible]-પૂજા [illegible] ચાદરના [illegible] રહ્યા છે.

ઈમામશાહ બાવા [illegible] આ જગ્યા અને તેની [illegible] જમીનોના વહીવટ છેલ્લાં ૫૦૦ વર્ષથી એક

જામનગરના રાજા

મનોહરસિંહ [illegible] વેચવા મુ[illegible]

આર્થિક [illegible]ના [illegible] જાડેજાની [illegible] રૂપિયાની [illegible]

[illegible]

અપાયેલી મંજૂરી સામે વિવિધ મનોહરસિંહજી જાડેજાનું ત્રણ મંજૂરી આપવામાં આવી છે. [illegible] શત્રુશલ્યસિંહજી ઉપર રૂપિયા [illegible] જમીન વેચવા ઈન્કાર કરાયા.

દિલ્હીનાં રાજ

ગુજરાતના તેમ જ ભારતના રાજવીઓએ નવી દિલ્હી ખાતે બાબતમાં રજૂઆતો કરી છે. કે [illegible] રાજકુટુંબોના વેલ્થ ટેક્સ તેમ એસ્ટેટ ડ્યુટીના જૂના લેણાંઓ બા[illegible] અને તેઓ એ ચૂકવી શકતા નથી એ[illegible] તેમને પણ તેમના દેવાં ભરવાં [illegible] જમીન ટોચમર્યાદા ધારામાંથી [illegible] મળવી જોઈએ એવી તેમની દલીલો [illegible] વિશ્વાસપાત્ર માહિતી અનુસાર દિ[illegible] પણ આ નિર્ણયથી આશ્ચર્ય થયું છે [illegible] ખાનગીમાં નારાજી પણ વ્યક્ત કર[illegible] આવી છે.

જામનગરના કેટલાક રાજ[illegible] વર્તુળોએ દિલ્હી ખાતે એવી રજૂઆત [illegible] છે કે શ્રી શત્રુશલ્યસિંહજી ઉપર એ [illegible]

નબળી કામગીરી

[છેલ્લા પાનાનું ચાલુ]

મળ્યો. શ્રી હરૂભાઈ મ[illegible] અમદાવાદની સંસદની બેઠકની [illegible] હરગીઝ નહીં આપવી જોઈએ [illegible] કાર્યકરોએ માગણી કરી હતી.

આજ રીતે રખિયાલ વિધાન મતવિસ્તારના રાયપુર અને બાપુન[illegible] કાર્યકરોએ વર્તમાન ધારાસભ્ય હસમુખ પટેલ સામે સખ્ત વિરોધ [illegible] હતો ને જણાવ્યું હતું કે વિધાનસભા [illegible] તેઓ હરગીઝ ચાલી શકે તેમ [illegible] તેમના સ્થાને બીજા ઉમેદવાર [illegible] કરવા જોઈએ નારણપુરા, વાડજ [illegible] સાબરમતીના કાર્યકરોએ વર્ત[illegible] ધારાસભ્ય શ્રી ભરત ગઢવી, [illegible] અમરાઈવાડી, ખોખરા [illegible] મણીનગરના કાર્યકરોએ વર્ત[illegible] ધારાસભ્ય શ્રી રામલાલ રૂપલાલ સામે [illegible] વ્યક્ત કર્યો હતો આ ધારાસભ્યો ચૂં[illegible] પછી લોકોના સંપર્કમાં રહ્યા નથી. [illegible] તેમની કામગીરીઓ નબળી છે. [illegible] રજૂઆતો થઈ હતી ને તેમને ટિ[illegible] નહીં આપવા માગણીઓ કરી હ[illegible]

આજે સવારે કીરદોશ ક્લેટ [illegible] હીરાલાલ ગુપ્તાના અધ્યક્ષપદે મળે[illegible] શહેર કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં [illegible] કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ[illegible] ચૂંટણીઓ કોંગ્રેસ માટે પડકારરૂપ [illegible] લોકકાર્યકરોએ શ્રી. રાજીવ ગાંધીના [illegible] મજબૂત કરવાના ક્રમમાં લાગી [illegible] જોઈએ. કોંગ્રેસને વિરોધ પક્ષનો [illegible] નથી.

શ્રી ગુપ્તાએ બંધ મીલો, [illegible] કામદારો, જીવન જરૂરી ચીજોના [illegible] ભાવ વિગેરે પ્રશ્નો રજૂ કર્યા હ[illegible]

અધમકામાનું રાજકારણ

ખંભાત: તાજેતરમાં કહે છે [illegible] પાણીના કકળાટની બાબતે સત્યનાર[illegible] ભારવાડાની બહેનોનો મોરચો [illegible] સામાજીક કાર્યકર શ્રી પીનાકીન બ્રહ્મ[illegible] ખંભાત નગરપાલિકાએ ગયેલા તેની [illegible] રાખી ચુનારા કોમના ચાર યુવાનોરે [illegible] છે. અમારા કાકા છગનભાઈ ચુનારા [illegible] કેમ ગયા હતા તેમ કહી હીરા ઘસ[illegible] કારખાનામાંથી અંગુરથી હુમલો [illegible] ગડદા પાટુનો માર મારતાં ખંભાતના [illegible] ગંદા રાજકારણ સામે લોકોમાં રોષ [illegible] સનસનાટી મચી જવા પામી હો[illegible] જાણવા મળે છે. સામ સામી પોલી[illegible] ફરિયાદો થયાનું પણ જાણવા મળે [illegible]

સારા વર્ષના નિશાની

મહેમદાવાદ : તાજેતરમાં સુસવાટા અને ધૂળની ડમરીઓ [illegible] આંધી સાથે મહેમદાવાદ તાલુ[illegible] મેઘરાજાની પધરામણી થતાં ખેડુ[illegible] આનંદની લાગણી ફેલાઈ છે. [illegible]

realpatidar.com